



SCALE: 1c.m.=20m.



This part plan is certified for the F.P NO: 2/1

Note:- (1) This part plan cannot be used for making any entry in revenue records and can not be considered

As Development Permission or Permission for Addition /Alteration .

(2) Final plots boundary and allotment of final plot as subject to variation.

નોંધ:- આ ફક્ત ટી.પી. સ્કીમ મુજબનો પાર્ટ-પ્લાન છે. રોડલાઈનની અસર/ઝોનિંગ વિગેરે બાબતો અંગે રીડીપી મુજબનાં પાર્ટ-પ્લાન/અભિપ્રાય મુજબ વર્તવાનું રહેશે.

અરજદાર દ્વારા ઇ.નં. 21050215/1074/તા. 18.02.15 થી
નકલની માંગણી કરેલ હોઈ પહોંચ નં. 7.33/104 તા. 18.02.15
રૂ. 1000/- વસુલ લઈ નકલ આપવામાં આવેલ છે.

LEGEND

- O.P BOUNDARY
- F.P BOUNDARY
- ROAD
- T.P.S. BOUNDARY

Prep. By


Chd. By:

H. D' man:

TRUE COPY

TOWN PLANNING INSPECTORE
TOWN DEVELOPMENT DEPARTMENT
AHMEDABAD MUNICIPAL CORPORATION
AHMEDABAD

PART PLAN SHOWING
R.S. NO.:- 527/1
VILLAGE :- NARODA
TALUKA:- ASARWA
DISTRICT:- AHMEDABAD




1 c.m. = 40 mt.

LEGEND

- Residential Zone I-R1
- Transit Oriented Zone-TZ
- Village Boundary
- TPS Boundary
- Existing Road
- Proposed Road
- BRTS

Part plan as per Second Revised Development Plan_2021
Prepared by AUDA and Final sanctioned U/s-17(1)(C) of
the G.T.P. & U.D. Act-1976 (Presidents act no.27 of 1976.)
by the Urban Development & Urban Housing Department-
Govt. of Gujarat vide its Notification No.GH/V/207
of 2014/DVP-112013-4777-L Dtd.20-12-2014.



This part plan is certified for the R.S. NO. :- 527/1

- NOTE :- (1) This part plan cannot be used for making any entry in revenue records and can not be considered as any Development Permission.
(2) This Part-Plan is as per RDP-2021. Please refer T.P.Scheme Part-Plan for details of TP Road & Boundary of Final Plot etc.

Application Inward No.:-RP2015/215/882/
Amount Received Rs. 1000/-
Receipt No. 733/101 Dtd. 18/2/2015.

TRUE COPY

Prep. By: *[Signature]*

Chd. By: *[Signature]*

H. D' man: *[Signature]*

TOWN PLANNING INSPECTOR
TOWN DEVELOPMENT DEPARTMENT
AHMEDABAD MUNICIPAL CORPORATION
AHMEDABAD.

નમુના અંક નિયમ ૨૧ અને ૩૫ મુનદારૂપ નગર રચના યોજના નં. ૧૨૧ (નરોગ-હંચુપુરા-કઠવાણ) પુનઃવહેણી અને કિંમતની આકારણીનું પત્રક ગુજરાત નગર રચના અને કોરોડી વિકાસ અધિનિયમ ૧૯૭૬											
અ.નં.	અ.નં.	માલિકનું નામ	રોડનું નંબર	સેક્ટર	મૂળખંડ			કિંમત રૂપિયામાં			
					સેક્ટર	કિંમત રૂપિયામાં	સેક્ટર	બાંધકામની કિંમત	બાંધકામની કિંમત	બાંધકામની કિંમત	બાંધકામની કિંમત
અ.નં.	અ.નં.	માલિકનું નામ	રોડનું નંબર	સેક્ટર	સેક્ટર	સેક્ટર	સેક્ટર	સેક્ટર	સેક્ટર	સેક્ટર	સેક્ટર
૧	૨	કીરીટકુમાર રમણલાલ	૩	૩ (અ)	૪	૫	૬ (અ)	૬ (અ)	૬ (અ)	૬ (અ)	૬ (અ)
૨	૩	સુરેશકુમાર રમણલાલ	૪	૪ (અ)	૫	૬ (અ)	૬ (અ)	૬ (અ)	૬ (અ)	૬ (અ)	૬ (અ)

PREPARED BY
CHECKED BY

સીલ રજીસ્ટરમાં પ્રમાણિત કરવામાં આવેલ છે.

F20150215/10742

TRUE COPY

Town Planning Inspector

Ahmedabad Municipal Corporation

Ahmedabad

परीच नं. ७३३/१०२

અગાઉના પાના પર. ૨૦૦ (૨૦૨૦)
૨૦૦, ૨૦૧, ૨૦૨૦
૨૦૨૦, ૨૦૨૦, ૨૦૨૦

ઓનિંગ સર્ટિફિકેટ

ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ- ૧૯૭૬ની કલમ ૧૭(૧)(ક) હેઠળની જોગવાઈઓ અન્યથે રાજ્ય સરકારશ્રી દ્વારા મંજૂર થઈ તા.૨૦/૧૨/૨૦૧૪ થી અમલમાં આવેલ ઔડા દ્વારા તૈયાર થયેલ દ્વિતીય પુનરાવર્તિત વિકાસ યોજના-૨૦૨૧ મુજબના નકશાના આધારે.

મોજે/રિવન્યુ ગામ :- ગાંધી

રેવન્યુ સર્વે નંબર :- ૧૮૭/૨

21. 2. 44. शीट नं० १०

ની જમીન રહેણાંક ઝોન- ૧ (એક) R1 માં આવે છે. 13RTS સખ્ત સંદર્ભિત કલમ 12(2)(ગ) મુજબ નોંધ: ટાનિડ 2 સોરોસપેટેડ કમ્પાની - 12 માં સાલ છે

૧. સદરહુ જમીન ડ્રાફ્ટ ટાઉન પ્લાનિંગ સ્કીમ નં. ૨૨૩ નરહો હે સપેરી નફલાઈ (ફા. ફા. ફા.)

વિસ્તારમાં આવતી હોવાથી તેને ટા. પ્લા. સ્કીમ હેઠળની અન્ય દરખાસ્તો - જોગવાઈઓ ફેરફારને તથા

ટાઉન પ્લાનિંગ ઓફિસરશ્રીના નિર્ણયને બંધનકર્તા રહેશે.

૨. આ ફક્ત ઓનિંગ સર્ટિફિકેટ છે, બાંધકામની પરવાનગી નથી.

তারিখ: ২৬-২-২০১৫

4
31/02/15
જી. ગ્રાફ્ટસમેન

હેડ ડાક્ટરસમેન

ખરી નકલ

તાઉન પ્લાનિંગ ઈન્સ્પેક્ટર
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
અમદાવાદ.